

માનનીય અદ્યક્ષશ્રી,

આજે રાજ્યના ઉર્જવાન નાણાં મંત્રી આદરણીય શ્રી કનુભાઈ નાણાં અને ઉર્જ વિભાગની માંગણીઓ લઈને આવ્યા છે. તેના ઉપર મારા વિચારો રજુ કરું છું.

માનનીય અદ્યક્ષશ્રી,

વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ચાણક્ય એ કહ્યું છે કે, કોઈપણ રાજ્યના સુશાસન માટે નાણાંની સુયોગતા એ પાચાનો સિદ્ધાંત છે.

માનનીય અદ્યક્ષશ્રી,

જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી નાણાંનું સુયોગ આયોજન થાય તે બાબતે અમારી સરકારે સતત ચિંતા કરી છે.

માનનીય અદ્યક્ષશ્રી,

મારે GST ની વાત કરવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમયાન રાજ્યને થયેલ આવક અને વેપારીઓને આપવામાં આવેલ છુટછાટની વાત કરું તો રાજ્યમાં GST ના સુચારુ અમલીકરણના લીધે આવકમાં ઉત્તરોત્તર વધાડો થયો છે.

માનનીય અદ્યક્ષશ્રી,

GST ની અમલવારી થઇ એટલે કે વર્ષ ૨૦૧૭-૧૮માં GST તેમજ વેટ હેઠળ રાજ્યવેરાની આવક અંદાજે રુદ્ધ હજાર કરોડ હતી. જેમાં માત્ર પંચ વર્ષમાં બમણો વધારો થયો અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા એક લાખ ચાર હજાર કરોડથી પણ વધારે આવક થઇ છે એટલે કે, આવકની દ્રષ્ટીએ ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં GST હેઠળની આવકનો ગ્રોથ ૧૬ ટકા રહ્યો છે. એ રાજ્ય સરકારના અસરકારક વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે.

માનનીય અધ્યક્ષશ્રી,

વેરો વસુલ કરવો એ જ આપણી જવાબદારી નથી. વેટ, સેસ, વ્યવસાય વેરો અને વીજ કર કાયદા હેઠળ આપવામાં આવેલ કેટલીક રાહતો પણ છે.

દાખલા તરીકે તા. ૦૧-૧૦-૨૦૨૩થી વિવિધ અપ્રત્યક્ષ કર કાયદાઓ જેવા ડે, વેટ, સેસ, વ્યવસાય વેરો અને વીજકર અંતર્ગત વાર્ષિક દર ૧૮ ટકા હતો. જે ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવેલ છે. જેનાથી વેપારી વર્ગને ખુબ મોટી રાહત થઈ છે.

માનનીય અધ્યક્ષશ્રી,

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ઉઘરાવવામાં આવતો વેરા નો દર અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો જ ઓછો છે. પેટ્રોલ અને ડીઝલમાં તા. ૦૪-૧૧-૨૦૨૧ના રોજ વેટમાં ખુબ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના લીધે ૮૦૦૦ કરોડનો વેરો જતો કરી પ્રજાને સીધો ફાયદો આપવામાં આવ્યો છે.

માનનીય અધ્યક્ષશ્રી,

છીકલમાં ફ્યુઅલ એટલે કે દ્યંઘણ તરીકે વપરાતા CNG ઉપર તા. ૧૮-૧૦-૨૦૨૪થી વેટનો દર ઘટાડી ૧૫ ટકાથી ઘટાડી ૫ ટકા કરેલ છે. જેનો સીધો લાભ CNG વાહનદારકોને મળી રહ્યો છે.

રાજ્યમાં ઘરઘણ્યુ વપરાતા PNG ગેસ ઉપર તા. ૦૫-૧૦-૨૦૨૩ના રોજ ૧૫ ટકામાં ઘટાડો કરી ૫ ટકા કરેલ છે. જેનો સીધો લાભ ગૃહિણીઓને થઈ રહ્યો છે.

માનનીય અધ્યક્ષશ્રી,

- GST કાચદા હેઠળ આપવામાં આવતી રાહતોની વાત કરું તો સ્થાનિકક્ષાએ રોજગારીમાં ઉપયોગમાં લેવાતી ઈમીટેશન ઝરી થ્રેડ તેમજ મેટલાઈડ ચાર્ન જેવી ચીજવસ્તુઓ ઉપર વેરાના દરમાં ઘટાડો કરી ૧૮ ટકામાંથી ૫ ટકા કરેલ છે.
- એજયુકેશનલ ઈન્સ્ટીટ્યુશન્સમાં પ્રવેશ માટે એન્ટ્રેન્સ એક્ઝામ લેતી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કોઇપણ સંસ્થા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને વેરામાંથી મુક્તિ આપી વિદ્યાર્થી ઉપર વેરાનું ભારણ દુર કર્યું છે.
- નાના ગૃહ ઉધોગોને પ્રોત્સાહન આપવા ફાયર્સ માટેના કાચા માલ ઉપર વેરાનો દર ૧૮ ટકાને બદલે ૫ ટકા કરેલ છે.
- સુગર મિલમાંથી બાયપ્રોડક્ટ તરીકે નિકળતા Molasses નાં સપ્લાય પર ૨૮% ને બદલે ૫% વેરો કરવામાં આવેલ છે. જેને પગલે ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપવા સારુ બાયોઇથેનોલ સસ્તુ થશે.
- તમામ પ્રકારનાં સપ્લાયર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઈટ લોંચ સર્વિસીસ ને વેરામાફીનો લાભ આપવામાં આવેલ છે, જે અગાઉ ફક્ત ઇસરો, એન્ટ્રીક્સ કોર્પોરેશન લીમીટેડ અને ન્યુ સ્પેસ ઇન્ડિયા લીમીટેડ ને જ મળવાપાત્ર હતો. આ પગલાને લીધે “મેક ઇન ઇન્ડીયા” ને પ્રોત્સાહન મળશે.
- પ્રૌષ્ઠીક આહારને પ્રોત્સાહન આપવા માટે પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ ન હોય તેવાં ૭૦% થી વધુ જાડા ધાનના લોટમાંથી બનાવેલ ખાદ્ય વસ્તુ પર વેરામુક્તિ આપવામાં આવેલ છે.

➤ માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જ વિભાગમાં નવા સબ સ્ટેશનની વાત કરીએ તો.....

- ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ફક્ત ૪૨ સબસ્ટેશનો અરિતત્વમાં હતા.
- વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ સુધીમાં એટલેકે ૪૨ વર્ષમાં નવાં સબસ્ટેશનો  
– ૭૦૪(વાર્ષિક સરેરાશ – ૧૭)
- વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં એટલેકે ૨૧ વર્ષમાં નવાં સબસ્ટેશનો  
– ૧૬૧૨(વાર્ષિક સરેરાશ – ૭૭)
- એટલેકે ૪૨ વર્ષની વાર્ષિક સરેરાશ કરતાં ૨૧ વર્ષની વાર્ષિક સરેરાશ ૪.૫  
ગણાથી પણ વધુ.
- છેદ્ધા ૧૦ વર્ષથી રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૮૬ નવાં સબસ્ટેશનો  
બનાવવામાં આવે છે.

વર્ષ	સબ-સ્ટેશનો	
૨૦૧૩-૧૪	૧૨૦	● અગાઉ કોંગ્રેસ સરકારના શાસનમાં વર્ષે માત્ર ૧૫ થી ૨૦ જ સબ સ્ટેશનો બનતા હતા.
૨૦૧૪-૧૫	૧૦૦	● છેદ્ધા ૧૦ વર્ષમાં વર્ષે સરેરાશ ૮૬ થી વધારે નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૫-૧૬	૮૮	● ૨૦૨૦-૨૧માં ૧૫૩ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૬-૧૭	૧૦૦	● ૨૦૨૧-૨૨માં ૭૦ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૭-૧૮	૧૦૧	● ૨૦૨૨-૨૩માં ૬૭ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૮-૧૯	૮૮	● ૨૦૨૩-૨૪માં ૮૫ નવાં સબ સ્ટેશનો બનાવવાનો લક્ષ્યાંક છે.
૨૦૧૯-૨૦	૫૫	● ૨૦૨૪-૨૫માં ૮૫ નવાં સબ સ્ટેશનો
૨૦૨૦-૨૧	૧૫૩	
૨૦૨૧-૨૨	૭૦	
૨૦૨૨-૨૩	૬૭	
૨૦૨૩-૨૪	૮	
કુલ	૮૭૪	

## આદિવાસી વિસ્તારમાં નવાં સબ સ્ટેશનની વાત કરીએ તો.....

- ગુજરાત રાજ્યની સ્થાપના સમયે આદિવાસી વિસ્તારમાં ફક્ત ૧ સબસ્ટેશન અસ્થિત્વમાં હતું.
- વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ સુધીમાં એટલેકે ૪૨ વર્ષમાં નવાં સબસ્ટેશનો – ૭૬ (વાર્ષિક સરેરાશ - ૨)
- વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં એટલેકે ૨૧ વર્ષમાં નવાં સબસ્ટેશનો – ૨૮૨ (વાર્ષિક સરેરાશ - ૧૪)
- એટલેકે ૪૨ વર્ષની વાર્ષિક સરેરાશ કરતાં ૨૧ વર્ષની વાર્ષિક સરેરાશ જ ગણી.
- છેદ્ધા ૧૨ વર્ષથી રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં ૬૨ વર્ષે સરેરાશ ૧૮ નવાં સબસ્ટેશનો બનાવવામાં આવે છે.

વર્ષ	સબ-સ્ટેશનો	
૨૦૧૧-૧૨	૧૧	● અગાઉ કોંગ્રેસ સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં વર્ષે સરેરાશ માત્ર ૨ જ સબ સ્ટેશનો બનતા હતા.
૨૦૧૨-૧૩	૧૦	● છેદ્ધા ૧૨ વર્ષમાં આદિવાસી વિસ્તારમાં વર્ષે સરેરાશ ૧૮ જેટલા નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે
૨૦૧૩-૧૪	૧૧	● ૨૦૨૦-૨૧માં આદિવાસી વિસ્તારમાં ૪૭ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે .
૨૦૧૪-૧૫	૨૫	● ૨૦૨૧-૨૨માં આદિવાસી વિસ્તારમાં ૦૮ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે .
૨૦૧૫-૧૬	૨૧	● ૨૦૨૨-૨૩માં આદિવાસી વિસ્તારમાં ૧૬ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે .
૨૦૧૬-૧૭	૨૧	● ૨૦૨૩-૨૪માં ૧૮ નવાં સબ સ્ટેશનો બનાવવાનો લક્ષ્યાંક છે.
૨૦૧૭-૧૮	૧૧	● ૨૦૨૪-૨૫માં ૧૮ નવાં સબ સ્ટેશનો બનાવવાનો લક્ષ્યાંક છે.
૨૦૧૮-૧૯	૨૧	
૨૦૧૯-૨૦	૨૨	
૨૦૨૦-૨૧	૪૭	
૨૦૨૧-૨૨	૯	
૨૦૨૨-૨૩	૧૬	
૨૦૨૩-૨૪	૦	
<b>કુલ</b>	<b>૨૨૫</b>	

➢ દરિયાકાંઠા વિસ્તારમાં નવાં સબ સ્ટેશનની વાત કરીએ તો.....

- ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં ફક્ત 3 સબસ્ટેશન અસ્થિત્વમાં હતા.
- વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ સુધીમાં એટલેકે ૪૨ વર્ષમાં નવાં સબસ્ટેશનો – ૧૨૧ (વાર્ષિક સરેરાશ - 3)
- વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં એટલેકે ૨૧ વર્ષમાં નવાં સબસ્ટેશનો – ૨૫૫ (વાર્ષિક સરેરાશ - ૧૩)
- એટલેકે ૪૨ વર્ષની વાર્ષિક સરેરાશ કરતાં ૨૧ વર્ષની વાર્ષિક સરેરાશ જ ગણીથી પણ વધુ.

વર્ષ	સબ-સ્ટેશનો	
૨૦૧૧-૧૨	૧૪	● અગાઉ કોંગ્રેસ સરકારના શાસનમાં દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષે સરેરાશ માત્ર ૩ જ સબ સ્ટેશનો બનતા હતા.
૨૦૧૨-૧૩	૧૯	● છેદ્ધા ૧૨ વર્ષમાં દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષે સરેરાશ ૧૬ જેટલા નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૩-૧૪	૧૩	● ૨૦૨૦-૨૧માં દરિયાકાંઠા વિસ્તારમાં ૨૮ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૪-૧૫	૧૭	● ૨૦૨૧-૨૨માં દરિયાકાંઠા વિસ્તારમાં ૧૫ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૫-૧૬	૧૩	● ૨૦૨૨-૨૩માં દરિયાકાંઠા વિસ્તારમાં ૧૦ નવાં સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
૨૦૧૬-૧૭	૧૬	● ૨૦૨૩-૨૪માં ૧૮ નવાં સબ સ્ટેશનો બનાવવાનો લક્ષ્યાંક છે.
૨૦૧૭-૧૮	૨૦	● ૨૦૨૪-૨૫માં ૧૯ નવાં સબ સ્ટેશનો બનાવવાનો લક્ષ્યાંક છે.
૨૦૧૮-૧૯	૧૪	
૨૦૧૯-૨૦	૭	
૨૦૨૦-૨૧	૨૮	
૨૦૨૧-૨૨	૧૫	
૨૦૨૨-૨૩	૧૦	
૨૦૨૩-૨૪ (ડિસે.૨૩)	૨	
<b>ફલ</b>	<b>૧૮૮</b>	

## વિજ ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાત

- ગુજરાત વીજ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર રાજ્ય બનેલ છે
- એટલુ જ નહીં ઉર્જા સરપલસ રાજ્ય બનેલ છે
- છેલા દાયકામાં ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં ઘણો વધારો થયેલ છે
  - વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ (૪૨ વર્ષ દરમિયાન) રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા **૮,૭૫૬ મેગાવોટ**
  - વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ (૨૧ વર્ષ દરમિયાન) રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો **૩૮,૬૩૬ મેગાવોટ**
  - હાલમાં રાજ્યની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા **૪૮,૬૬૨ મેગાવોટ**
  - માત્ર ૨૧ વર્ષમાં **૬** ગણાથી વધુ જેટલો વધારો
  - સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

## \* સૌર અને પવન ઉર્જામાં અગ્રેસર ગુજરાત

- સૌર ઉર્જા
  - અગાઉ સૌર ઉર્જા માટે કોઈ નીતિ ન હતી
  - આ સરકારે વર્ષ ૨૦૦૮માં દેશમાં પહેલી વાર સૌર ઉર્જા નીતિ જાહેર કરેલ તથા વર્ષ ૨૦૧૫ અને ૨૦૨૧માં સંશોધિત સૌર ઉર્જા નીતિ જાહેર કરેલ છે.
  - વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ (૪૨ વર્ષ દરમિયાન) રાજ્યની સૌર ઉર્જાની વીજ ઉત્પાદન **શુન્ય મેગાવોટ**
  - વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ (૨૧ વર્ષ દરમિયાન) રાજ્યની સૌર ઉર્જાની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો **૧૦,૫૪૮ મેગાવોટ**
  - **સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા બાબતે રાજ્ય દેશમાં દ્વિતીય ક્રમાંકે છે.**
  - કડી તાલુકાના ચંદ્રાસણ ખાતે કેનાલ હેડ સોલાર પ્રોજેક્ટ દ્વારા ૧ મેગાવોટનું સૌર ઉર્જા ઉત્પાદન કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
  - વડોદરા જિલ્લાની નર્મદા નહેર પર ૩૫ મેગાવોટ કેનાલ હેડ સોલાર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા ઉત્પાદન કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

## ➤ પવન ઉર્જા

- અગાઉ પવન ઉર્જા માટે કોઈ નીતિ ન હતી .
- આ સરકારે વર્ષ ૨૦૦૮માં પવન ઉર્જા નીતિ જાહેર કરેલ તથા વર્ષ ૨૦૧૫માં સંશોધિત નવી પવન ઉર્જા નીતિ જાહેર કરેલ .તદુપરાંત ૨૦૧૮માં વિનિ સોલાર પોલિસી સંશોધિત નીતિ જાહેર કરેલ.
- વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૨ (૩૨ વર્ષ દરમિયાન) રાજ્યની પવન ઉર્જાની વીજ ઉત્પાદન ક્ષમતા ૮૮ મેગાવોટ
- વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ (૨૧ વર્ષ દરમિયાન) રાજ્યની પવન ઉર્જાની વીજ ઉત્પાદન ક્ષમતામાં ૧૧,૧૨૪ મેગાવોટ
- **પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા બાબતે રાજ્ય દેશમાં પ્રથમ કમાડો છે.**

## ➤ સોલાર પાર્કનું નિર્માણ

- બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રના વિકાસમાં ગુજરાત રાજ્ય અગ્રણી રહ્યું છે.
- એશિયા ના સૌપ્રથમ ૭૦૦+ મેગાવોટના ચારણકા સોલાર પાર્કનું નિર્માણ ક્રમાં થયેલ. જેના અનુસંધાને **૭૩૦ મેગાવોટ** સૌર ઉર્જા આધારિત વીજ ઉત્પાદન હાલ ચાલુ થઈ ગયેલ છે .
- ત્યાર બાદ વધુ બે સોલાર પાર્ક....
  - ✓ **૧૦૦૦ મે.વો.** ધોલેરા સોલાર પાર્કનું તથા
  - ✓ **૭૦૦ મે.વો.** રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણ હાલ ચાલુ છે

### ❖ ધોલેરા સોલાર પાર્ક (**ફક્ત -૧, ૧૦૦૦ મે.વો**)

- ✓ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જીલ્લાના ધોલેરા તાલુકામાં ધોલેરા (SIR) ખાતે અલ્ટ્રામેગા સોલાર પાર્ક સ્થાપવા માટે મંજુરી આપવામાં આવેલ,
- ✓ ગુજરાત સરકાર **ઝારા** ધોલેરા (SIR) ખાતે પ્રાથમિક તબક્કે **૧૦,૦૦૦ મે.વો.** સોલાર પાર્ક (૩૪-૧) કરવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. જે પૈકી હાલ **૩૦૦ મેગાવોટ** સૌર ઉર્જાનું ઉત્પાદન ચાલુ છે.

## **❖ ૭૦૦ મે.વો. રાધાનેસડા સોલાર પાર્ક**

- ✓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જીલ્હાના વાવ તાલુકામાં રાધાનેસડા ગામ ખાતે ૧૪૦૭ હેકટર જેટલી પડતર જમીનમાં **૭૦૦+** મે.વો. અલ્ટ્રામેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજુરી મળેલ છે.
- ✓ જે પૈકી હાલ **૫૦૦ મેગાવોટ** સૌર ઊર્જાનું ઉત્પાદન ચાલુ છે.

## **➢ સોલાર-વિન્ડ હાઇબ્રીડ પાર્ક:**

- ✓ તા. ૧૫.૧૨.૨૦૨૦ ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરે જીલ્હાના વીધાકોટ બીએસએઝ પોસ્ટ પાસે વિશ્વનો સૌથી મોટો **૩૦,૦૦૦ મેગાવોટનો** વિન્ડ સોલાર પાર્કનું ખાત-મુહૂર્ત કરવામાં આવેલ છે, જે આવનાર ૧૦ વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવામાં આવશે.
- ✓ આ વિન્ડ સોલાર પાર્કના કારણે રાજ્યમાં અંદાજે રૂ. ૧,૨૦,૦૦૦ કરોડ ઉપરાંત રોકાણ થવાને કારણે રોજગારના અનેક નવા અવસર ઊભા થશે.

## **રિવેન્યુ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ - RDSS**

- સમગ્રે દેશના તમામ ગામો અને શહેરોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત શ્રી-ફેઝ ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તેમજ વીજ પુરવઠાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે કેન્દ્રના ઊર્જ મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ અમલી મૂકવામાં આવેલ છે તે પૈકીની એક યોજના એટલે **રિવેન્યુ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ.**
- આ યોજના હેઠળ **૫૦%** ફાળો કેન્દ્ર સરકાર તરફથી અને બાકીના **૪૦%** ફાળાની રકમ રાજ્ય સરકાર દ્વારા મૂડીસહાય સદરે આપવાની જોગવાઈ કરેલ છે.

- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તે માટે વીજ માળખાનું આધુનિકીકરણ અને સૂદ્રફિકરણ કરવાનો છે.
- કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાં **₹.3,03,758 કરોડના** નાણાંકીય આયોજન સાથે રિવેઝ્ન ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ શરૂ કરવામાં આવેલ છે જે પૈકી ગુજરાતમાં **₹.૨૦,૭૨૬ કરોડના** પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં વીજ માળખાના આધુનિકીકરણ માટે **₹.૧૦૬૦૨ કરોડ** અને વીજ માળખાના સુદ્રફિકરણ માટે **₹.૧૦૧૨૪ કરોડ** ફાળવવામાં આવેલ છે.
- આ યોજના હેઠળ વીજ માળખાના મોનિટરિંગ માટેની SCADA સિસ્ટમ તેમજ વીજ માળખાના સુદ્રફિકરણ માટેની કામગીરી જેમ કે ખુદ્ધા વીજ વાયરને બદલે એરિયલ-બંચ કેબલ તથા કોટેડ વીજ વાયર નાખવા, દરિયાઈ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં હચાત ફિડરનું અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણ, ફિડરનું વિભાજન , જૂના / જર્જરિત વીજ વાયરો બદલી નવા વીજ વાયરો નાખવા, નવા ટ્રાન્સફોર્મર લગાવવા તેમજ હચાત ટ્રાન્સફોર્મરની કેપેસીટીમાં વધારો કરવો, વગેરે કામગીરી કરવામાં આવશે.

### **“સૂર્ય ગુજરાત” રેસિડેન્શિયલ રૂફટોપ સોલાર યોજના**

- રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપ ને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ ૫-૮-૨૦૧૮ના રોજ સૂર્ય ગુજરાત યોજનાની જાહેરાત કરવામાં આવેલ.
- સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે.
  - તા. ૩૧.૧૨.૨૦૨૩ની સ્થિતિએ દેશભરમાં કુલ ૧૦,૬૮૧ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફ-ટોપ સિસ્ટમ સ્થાપિત થયેલ છે. તે પૈકી

ગુજરાતમાં ૩૨૬૫ મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત થયેલ છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના ૩૦% ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.

- કુલ ૨૪૭૩ મેગાવોટ સોલર રૂફટોપ સિસ્ટમ પૈકી ૨૦૨૫ મેગાવોટ રહેણાંક ક્ષેત્રે લાગેલ છે. રહેણાંક ક્ષેત્રે ગુજરાત રાજ્યનો દેશભરમાં ફાળો ૮૨% છે.
  - આ પ્રકારની મોટા પ્રમાણમાં સોલાર રૂફટોપ અરજીની નોંધણી ગુજરાત અને ભારતમાં પ્રથમવાર થઈ છે.
  - રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઊર્જા ઉત્પન્ન કરી સ્વ-વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં વહેંચી આવક મેળવી રહ્યા છે.
  - વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલ વધારાની વીજળી વીજવિતરણ કંપની ઝારા ૩. ૨.૨૫ ના દરે ખરીદવામાં આવે છે.
  - સોલાર રૂફટોપ ના વિશાળ કામના ઝડપી અમલીકરણ કદદ એજન્સીઓને શહેરી વિસ્તાર અને પ્રજા એજન્સીઓને ગ્રામ્ય વિસ્તાર માટે નિયત કરવામાં આવેલ છે.